



RAN-1905090103040002

LL.M (Sem. -III) Examination November - 2025

Law Of Insurance - II

[Total Marks: 70

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- Q.1.** વીમા ધારા 1938 હેઠળની ટેરીફ સલાહકાર સમિતિ અને ટેરીફ દર પર ના નિયંત્રણો સમજાવો. 14
Explain Tariff advisory Committee and restrictions on Tariff rates under Insurance Act, 1938.
- OR**
- Q.1.** વીમો અને ગ્રાહક સુરક્ષા ધારો, 2019 કેસ લો ટાંકી ચર્ચા કરો. 14
Insurance and Consumer Protection Act, 2019 .Discuss with Case Laws.
- Q.2.** ટૂંક નોંધ 1. સમુદ્રના જોખમો 2. દાવાની પતાવટ 14
Short Note : 1. Perils of the Sea 2.Settlement of Claim
- OR**
- Q.2.** દરિયાઈ વીમા અન્વયે તેની નીતિઓનું સ્વરૂપ અને વર્ગીકરણ વર્ણવો. 14
Describe the Nature and Classification of Policies of Marine Insurance.
- Q.3.** આગના વીમા વિષે સમજાવો. આગના વીમાની સુવિધાઓ વિષે ચર્ચા કરો. 14
Explain Fire Insurance. Discuss feature of Fire Insurance.
- OR**
- Q.3.** આગના વીમાના કરારનું સ્વરૂપ સમજાવો અને તેમાં ક્ષતિપૂર્તિના સિદ્ધાંતનું મહત્વ સમજાવો 14
Explain the Nature of Contract of Fire Insurance and Explain the importance of Principle of Indemnity.
- Q.4.** જીવન વીમા પોલિસી જારી કરવાની પ્રક્રિયા સમજાવો. 14
Explain the Procedure for issuing the Life Insurance Policy
- OR**
- Q.4.** વીમા અધિનિયમ 1956 નું મહત્વ સમજાવી ભવિષ્ય ના દ્રષ્ટિકોણ સમજાવો. 14
Explain importance of Life Insurance Act 1956 and its future outlook

Q.5. Write Short notes any two (કોઈ પણ બે ટૂંક નોંધ)

14

1. વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ (આઈઆરડીએ)
Insurance Regulatory and Development Authority (IRDA)
 2. પોલિસી નું અસાઈમેન્ટ
Assignment of Policy
 3. સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 2002 નો હેતુ અને મહત્વ
Objective and importance of General Insurance Business (Nationalization) Act 2002
 4. વીમાપાત્ર વ્યાજ અને વીમાપાત્ર મૂલ્ય
(Insurable interest and insurable value)
-